



Gujarat Common Admission Services (GCAS) Education Department, Government of Gujarat

વિદ્યાર્થીના ફોર્મ ફીલિંગ માટે ક્વિક રજિસ્ટ્રેશનની માર્ગદર્શિકા

શૈક્ષણિક વર્ષ 2025 – 2026માં GCAS દ્વારા થનાર પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન તમામ સરકારી કોલેજો, અનુદાનિત કોલેજો, યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ/ભવનો તથા સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થી વિના મૂલ્યે પોતાનું ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકશે.

વિદ્યાર્થીએ ક્વિક રજિસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા:

જે વિદ્યાર્થી પોતે ક્વિક રજિસ્ટ્રેશન કરવા ઇચ્છતા હોય તેમણે નીચેની માર્ગદર્શિકા પ્રમાણે ક્વિક રજિસ્ટ્રેશન કરવું.

સૌ પ્રથમ GCAS પોર્ટલ <https://gcas.gujgov.edu.in/> પર જાઓ અથવા QR કોડ સ્કેન કરો.



GCAS પોર્ટલ <https://gcas.gujgov.edu.in/> પર જવાથી અથવા QR કોડ સ્કેન કરવાથી GCASનું હોમપેજ ખુલશે જેમાં Apply Now પર ક્લિક કરવાનું રહેશે.

The screenshot displays the GCAS Admissions portal. On the left, there is a 'Student Login' form with fields for User Name, Password/COTP, a dropdown menu, and a Password field. Below the form is a CAPTCHA challenge: 'Total of 34 + 2 ='. On the right, a circular flowchart titled 'GCAS Admissions' outlines the process in five steps: 01 Form Filling (Online form filling at nearest Form filling Centre at no cost), 02 Form Verification (Form Verification at nearest Verification Centre at no cost), 03 Release of Merit List (Preparation and Release of Merit List by College/University), 04 Offer Confirmation (Confirmation of online admission by OTP on basis of Merit List), and 05 Reporting (Reporting to College/University in allotted time to confirm admission). The 'Apply Now' button is circled in red in the top right corner of the portal.

Apply Now પર ક્લિક કરવાથી નીચે મુજબની Quick Registration માટેની એક વિન્ડો ખૂલશે. જેમાં જરૂરી વિગતો ભરવાની રહેશે.

Quick Registration

Program Type / અભ્યાસક્રમનો પ્રકાર*
--Please Select--

APAAR ID (ABC ID)/અપાર આઈ.ડી. (એબીસી આઈ.ડી.)

Name as per Marksheet / માર્ક્શીટ મુજબ નામ*

Category / કેટેગરી*
--Please Select--

Gender / જાતિ*
--Please Select--

Birth Date / જન્મ તારીખ*
DD-MM-YYYY

I hereby give my consent to communicate me about new initiatives of Education Department, Government of Gujarat through my Email ID and mobile number. હું આ સાર્થે મારા ઇ-મેઇલ આઈડી અને મોબાઇલ નંબર પર શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારની નવી પહેલો અને જવાબવા માટે સંમતિ આપું છું.

Email / ઇમેઇલ*
Mobile No. / મોબાઇલ નંબર*
Get OTP

[Back to Login](#)

- અભ્યાસક્રમનો પ્રકાર:** અહીં વિદ્યાર્થી જે અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઇચ્છે છે તે વિકલ્પ પસંદ કરવો. ઉદાહરણ તરીકે, જો વિદ્યાર્થી બી.એ. માં પ્રવેશ મેળવવા ઇચ્છે છે તો Under Graduate અભ્યાસક્રમ પસંદ કરવાનો રહેશે અને એમ.એ. માં પ્રવેશ મેળવવા ઇચ્છે છે તો Post Graduate અભ્યાસક્રમ પસંદ કરવાનો રહેશે.
- APAAR આઈ ડી (ABC આઈ ડી):** જો વિદ્યાર્થી પાસે APAAR આઈ ડી (ABC આઈ ડી) હોય તો અહીં દર્શાવવું.
- માર્ક્શીટ મુજબ નામ:** વિદ્યાર્થીની SSC/HSCની માર્ક્શીટ/સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્રમાં દર્શાવ્યા મુજબનું પોતાનું નામ લખવાનું રહેશે.
- કેટેગરી:** સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ કેટેગરી અંગેના પ્રમાણપત્ર મુજબની વિદ્યાર્થીને લાગુ પડતી કેટેગરીના જ વિકલ્પની પસંદગી કરવાની રહેશે. જો વિદ્યાર્થી ઓપન કેટેગરીમાં આવતા હોય તેઓએ General વિકલ્પ પસંદ કરવો.
- જાતિ:** અહીં વિદ્યાર્થીએ તેઓને લાગુ પડતી જાતિ પસંદ કરવાની રહેશે.
- જન્મ તારીખ:** શાળા છોડ્યાના પ્રમાણપત્ર કે SSC ની માર્ક્શીટ ના આધારે, DD/MM/YYYY ફોર્મેટ મુજબ જન્મ તારીખ લખવાની રહેશે.
- બાહેંધરી:** અહીં વિદ્યાર્થીએ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોની માહિતી જો પોતાના મોબાઇલ કે ઈ-મેલમાં મેળવવા ઇચ્છતા હોય તો તે પ્રકારની સંમતિ પર ટીક કરવાનું રહેશે.
- મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી:** વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ મોબાઇલ નંબર તથા ઇમેઇલ આઈડી બંને પર અલગ અલગ OTP આવશે. આથી, વિદ્યાર્થી દ્વારા વપરાશમાં હોય તેવો મોબાઇલ નંબર તથા ઇમેઇલ આઈડી ફોર્મ ભરતી વખતે લખવાના રહેશે તથા પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
- OTP મેળવી ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા:** તમામ જરૂરી માહિતી ભર્યા બાદ 'Get OTP' પર ક્લિક કરવું. ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ ઇમેઇલ આઈડી તથા મોબાઇલ નંબર પર અલગ-અલગ OTP આવશે. આ બંને OTP એન્ટર કર્યા બાદ કેપ્ચા કોડ એન્ટર કરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ચુઝર નેમ અને પાસવર્ડ:** ક્લિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ આપે GCAS પર રજિસ્ટર્ડ કરાવેલ ઇમેઇલ આઈડી તથા મોબાઇલ નંબર પર, GCAS દ્વારા યુનિક લોગઈન આઈડી (ચુઝર નેમ) અને પાસવર્ડ મોકલવામાં આવશે. આ લોગઈન આઈડી (ચુઝર નેમ) તથા પાસવર્ડની મદદથી આપ GCASની પ્રવેશ પ્રક્રિયા માટેનું ફોર્મ ભરવા માટે લોગઈન કરી શકશો. આથી, આ લોગઈન આઈડી (ચુઝર નેમ) તથા પાસવર્ડ વિદ્યાર્થીએ સાચવી રાખવો.
